

સીધી ભરતી પસંદગી સમિતિ,

અનુસૂચિત જાતિ કલ્યાણ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

સામાજિક ન્યાય, અને અધિકારીતા વિભાગ સચિવાલય ગાંધીનગર ના નિયંત્રણ હેઠળની નિયામકશ્રી અનુ જાતિ કલ્યાણ ગાંધીનગરની કચેરી ઉપરાંત રાજ્યની જિલ્લા કચેરીઓમાં વર્ગ-૩ની કચેરી અધિક્ષક અને તેની સમકક્ષ સંવર્ગની જગ્યાઓ પર સીધી ભરતીની મેરીટ યાદી તૈયાર કરવા માટે આ જગ્યાના ભરતી નિયમો મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં <http://ojas.guj.nic.in> અથવા <http://ojas1.guj.nic.in> વેબસાઈટ તા.૨૦/૯/૨૦૧૨ (બપોર ૨-૦૦ કલાક) થી તા.૧૦/૧૦/૨૦૧૨ (સમય રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમિયાન અરજી મંગાવવામાં આવે છે. ઉમેદવારે તાજેતરનો પાસપોર્ટ ફોટોગ્રાફ (15kb) અને સહીનો નમુનો (15kb) સાઈઝથી વધે નહી તે રીતે jpg ફોર્મેટમાં સ્કેન કરી ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. ઉમેદવારે પોતાના શૈક્ષણિક ,વય અને જાતિ તેમજ લાયકાત ના બધાજ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે.અને અરજી પત્રકમાં તે મુજબની વિગતો ભરવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા માટેની પરીક્ષા હેતુલક્ષી પશ્ચોવાળી ઓ.એમ.આર પધ્ધતીથી લેવામાં આવશે. પરીક્ષા સંદર્ભની બધીજ સુચનાઓ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ થી આપવામાં આવશે આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. તેમજ પસંદગીની તમામ પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી આ નંબર બદલવો નહી. ભરવાપાત્ર જગ્યાઓ સહ અનામતની ટકાવારી મુજબ જાતિવાર ભરવાની થતી જગ્યાઓની વિગત નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંક	સંવર્ગ	ભરવાની કુલ જગ્યા	અનુસૂચિત જાતિ			અનુસૂચિત જનજાતિ			સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ			બિનઅનામત		
			પુ	સ્ત્રી	કુલ	પુ	સ્ત્રી	કુલ	પુ	સ્ત્રી	કુલ	પુ	સ્ત્રી	કુલ
DSCW/ ૨૦૧૨/૧	કચેરી અધિક્ષક	૧૪	૧	૧	૨	૧	૧	૨	૩	૧	૪	૫	૨	૭

- અનામત જગ્યાઓ ફક્ત મુળ ગુજરાતના અનુસૂચિતજાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે.
- અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.નહીં.
- ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેઓ અનામત કેટેગરીમાં અરજી કરવા માંગે છે કે બિન અનામત કેટેગરીમાં અરજી કરવા માંગે છે તે સ્પષ્ટ જણાવવું. એક વખત ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ જાતિ/કક્ષામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા દેવામાં આવશે નહીં. જો કોઈ ઉમેદવાર પાછળથી આ બાબતે રજૂઆત કરશે તો, તેની રજૂઆત સ્વીકારવામાં આવશે નહી કે તેનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવશે નહી ઉમેદવારોને આ સુચના ધ્યાને લઈ તેનું અચૂકપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

- માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓનાં ૧૦૮૬ મુજબ જગ્યાઓ અનામત છે, જે તે કેટેગરી સામે સરભર કરાશે. માજી સૈનિક માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક માજી સૈનિક ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે જગ્યાઓ જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવાર થી ભરવામાં આવશે.
- મહિલાઓ માટેની જગ્યાઓ ૩૦ ટકા મુજબ અનામત છે. જે જે-તે કેટેગરી સામે સરભર કરાશે. મહિલા ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ જો લાયક મહિલા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે-તે કેટેગરીના પુરૂષ ઉમેદવારોથી જ ભરવામાં આવશે.
- સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૫/૯૭ ના પરિપત્ર ક્રમાંક સીઆઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨ અનુસાર વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને મળેલ કુલ ગુણના ૫(પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ તેઓએ ભરતી થતા નિમણુંક સમયે પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ. ઉપરાંત સમિતિ માંગે ત્યારે તેના તમામ પુરાવાઓ અસલમાં રજૂ કરવાના રહેશે.
- એથલેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રીકેટ, હોકી, ફૂટબોલ, સ્વિમીંગ , ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઈટલિફ્ટીંગ, રેસલીંગ, બોકસીંગ, સાઈકલીંગ, જીમનેસ્ટીક, જૂડો, રાઈફલશુટીંગ, કબડ્ડી, ખોખો, તિરદાંજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકાસ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો, ખેલકુદમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને મેળવેલ કુલ ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.આ માટે ઉમેદવારે સરકારે નક્કી કરેલ સત્તાધિકારીઓ પાસેથી મેળવેલ જરૂરી પ્રમાણપત્ર સરકારશ્રી માંગે ત્યારે રજૂ કરવાના રહેશે.
- ઉક્ત જગ્યાઓના વેતન અને પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત તથા વય મર્યાદાની વિગતો નીચે મુજબ છે.

સંવર્ગ	પગાર ધોરણ	પ્રથમ પાંચ વર્ષ માટે મળવા પાત્ર વેતન	શૈક્ષણિક લાયકાત.	વયમર્યાદા (અરજી સ્વીકારવાની છેલ્લી તા.....ની સ્થિતિએ)
અધિક્ષક	રૂ.૯૩૦૦-૩૪૮૦૦ (ગ્રેડ પે રૂ.૪૪૦૦)	રૂ. ૧૦,૦૦૦	ઉમેદવારો ભારતમાં કેન્દ્ર કે રાજ્યના વૈદ્યાનિક કાયદા હેઠળ માન્યતા મેળવેલ કોઈપણ યુનિવર્સિટીની સ્નાતકની પદવી અથવા સંસદના કાયદા હેઠળ સ્થપાયેલ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ,૧૯૫૬ ની કલમ ૩ હેઠળ ડીઝ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની અથવા સરકારે તેની સમકક્ષ જાહેર કરેલ શૈક્ષણિક લાયકાત મેળવેલ હોવી જોઈશે.	૨૮ વર્ષથી વધુ નહીં.

- નાણા વિભાગના તા.૧૬-૨-૦૬, તા.૧-૮-૦૬ તથા તા.૬-૧૦-૨૦૧૧ ના ઠરાવ તથા સામાન્ય વહીવટ વિભાગનાં તા.૪-૬-૦૯ નાં ઠરાવની જોગવાઈઓને આધિન જે બોલીઓ /શરતો/નિયમો નક્કી કરેલ છે તે તેમજ હવે પછી વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે બોલીઓ /શરતો / નિયમો ઉમેદવારોને બંધનકર્તા રહેશે. પ્રવર્તમાન જોગવાઈઓ આધિન પ્રથમ પાંચ વર્ષ માટે ઉપર દર્શાવ્યા મુજબના વેતનના ધોરણે લાયક ઉમેદવારોને અજમાયશી ધોરણે નિમણૂક અપાશે. તે સિવાય અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ પાંચ વર્ષની સંતોષકારક સેવાપૂર્ણ થયાની ખાત્રી થયા બાદ ઉપર જણાવેલ વિગતે અથવા સરકારશ્રી દ્વારા જે તે જગ્યા માટે વખતો વખત નિયત કરેલ મળવાપાત્ર પગાર ધોરણોમાં નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે.
- આ ભરતી રાજ્ય સરકાર દ્વારા નામ.સુપ્રિમકોર્ટમાં દાખલ કરવામાં આવેલ એલ.પી.એ.નં.૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધીન રહેશે.

૩. રાષ્ટ્રીયતા:- ઉમેદવાર ભારતનો નાગરીક હોવો જોઈએ.

૪. ઉમેદવાર ગુજરાતી/હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

૫. કોમ્પ્યુટર જાણકારી:-

ઉમેદવાર રાજ્ય સરકારનાં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો,૧૯૬૭ અન્વયે ઠરાવેલી કોમ્પ્યુટરના ઉપયોગ અંગે ની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. (૨).સામાન્ય વહીવટ વિભાગનાં તા.૧૨-૮-૦૮ ના સરકારી ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ.૫ થી નક્કી કરેલ અભ્યાસ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. તથા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતાં હોવા જોઈએ. આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ આ અરજી કરી શકશે. પરંતુ નિમણૂક મેળવતાં પહેલા આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે નહીં.

૬. વયમર્યાદામાં છૂટછાટ:-

- મુળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારોનાં કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં નિયમોનુસાર ૫ (પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
- વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગનાં તા.૦૧-૧૨-૨૦૦૮ ના પરીપત્ર ક્રમાંક:પરચ-૧૦૨૦૦૮-૪૬૯૫૪૦-ગ.૨ થી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડેન્ટ/સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્ર ને આધિન રહીને ઉપલી વયમર્યાદામાં ૧૦ (દશ) વર્ષની છૂટછાટ મળશે.
- સામાન્ય વહીવટ વિભાગનાં તા.૨૨-૫-૧૯૯૭નાં ઠરાવની જોગવાઈ મુજબ મહીલા ઉમેદવારોને પાંચ વર્ષની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

- માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ જળ, વાયુ, અને ભુમી આમર્ડફોર્સીસમાં ઓછામાં ઓછા ૬(છ) માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ/પ્રમાણપત્ર ધરાવતાં હોય તો મળવાપત્ર ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩(ત્રણ) વર્ષ સુધીની છૂટછાટ મળશે.

- **ખાસ નોંધ:-**

(૧) તમામ કેટેગરીનાં ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઈશે નહીં.

(૨) તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદામાં, શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, અનુભવ અને નોન કિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

૭. અરજી ફી સ્વીકારવા/જમા કરાવવા અંગે ની સુચના:-

(૧) બિન અનામત પુરૂષ/મહીલા ઉમેદવારોએ નજીકની કોઈપણ કમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફીસમાં રોકડેથી અરજી ફી રૂ. ૧૦૦/ અને રૂ. ૧૨/ સર્વિસ ચાર્જ એમ કુલ રૂ. ૧૧૨/ ભરવાની રહેશે. (૨) ઓનલાઈન અરજી કરતી વખતે અરજીપત્રમાં આપેલ ચલણ ની ૩(ત્રણ) નકલની હાર્ડ કોપી કાઢી પોસ્ટ ઓફીસમાં રજૂ કરવાથી પોસ્ટ ઓફીસ દ્વારા આ ફી સ્વીકારવામાં આવશે. (૩) ૩(ત્રણ) ચલણ પૈકી એક ચલણ પોસ્ટ ઓફીસ રાખશે. અને બીજા બે સહી/સિક્કા કરી ઉમેદવારને પરત કરશે જે ઉમેદવારે સાચવી રાખી પરીક્ષા સ્થળે અચૂક રજૂ કરવાનું રહેશે. જો પરીક્ષા સમયે ઉમેદવાર આ ચલણ રજૂ નહીં કરે તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. (૪) રોકડેથી ફી સ્વીકારવા માટે પોસ્ટ ઓફીસે નક્કી કરેલો ચાર્જ (રૂ.૧૦૦/+ રૂ.૧૨/ (પોસ્ટ ઓફીસ ચાર્જ) ભરી દેવાનો રહેશે **પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તારીખ.૧૨/૧૦/૨૦૧૨ (કચેરી સમય) સુધી છે.** (૫) પોસ્ટ ઓફીસમાં ફી ભર્યા પછી જો OJAS પરથી ફી મળ્યા બદલનો SMS ન મળે તો તુર્ત જ જે પોસ્ટ ઓફીસમાં ફી ભરી હોય તે પોસ્ટ ઓફીસને તેની જાણ કરવી અને તે અંગેની સ્પષ્ટતા મેળવી લેવી.(૬) મુળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારે અરજી ફી ભરવાની રહેતી નથી. (૭) મુળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારો એ જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો ફી ભરવાની રહેશે (૮) વિકલાંગ વ્યક્તિઓ તથા માજી સૈનિકોએ અરજી ફી ભરવાની રહેતી નથી. (૯) ફી ભર્યા બાદ રીફંડ મળવાપત્ર નથી.

કચેરી અધિક્ષક અને તેની સમકક્ષ સંવર્ગની જગ્યાઓ માટે:-

અધિક્ષક સંવર્ગની સ્પર્ધાત્મક લેખીત પરીક્ષામાં (MCQ Based) ૨૦૦ ગુણનું એક પેપર રહેશે. આ પેપરનો સમય ગાળો ૧.૩૦ કલાકનો રહેશે. હેતુલક્ષી પ્રકારના આ પેપરમાં સ્નાતક કક્ષાના સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્યના વિષય સંબંધિત બાબતો, ગુજરાતી અને અંગ્રેજી ભાષા તેમજ રોજ બરોજની મહત્વની બાબતોનો સમાવેશ થશે. આ પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબના કિસ્સામાં ૦.૨૫ માર્ક્સ જે તે જવાબના નિશ્ચિત ગુણના ગુણ ઉમેદવારે મેળવેલ ગુણમાંથી કાપવામાં આવશે. આ પેપરનું માધ્યમ મહદ્ અંશે ગુજરાતી રહેશે. આમાટે કોઈ મૌખિક ઇન્ટરવ્યુ / રૂબરૂ મુલાકાત રાખવામાં આવનાર નથી.

પરીક્ષાના કેન્દ્રો:- (સંભવિત)

અમદાવાદ , વડોદરા અને રાજકોટ

ઓન લાઈન મળેલ અરજીઓની સંખ્યાના આધારે કેન્દ્રમાં ફેરફાર થઈ શકશે.

પરીક્ષાની તારીખ- (સંભવિત) આ પરીક્ષા સંભવતઃ ઓક્ટોબર-૨૦૧૨ માં લેવામાં આવશે. તેમ છતાં પરીક્ષાની તારીખ નક્કી થયેથી ચોકકસ તારીખ <http://ojas.guj.nic.in> અથવા <http://ojas1.guj.nic.in> વેબસાઈટ પર પ્રદર્શિત કરવામાં આવશે.તદઉપરાંત અત્રેથી બહોળી પ્રસિધ્ધી ધરાવતા કોઈપણ બે દૈનિક વર્તમાન પત્રોમાં પણ તે અંગેની જાહેરાત અત્રેથી પ્રસિધ્ધ કરવામાં આવશે.

૯. સામાન્ય સુચનાઓ:-

- (૧) સદરહુ ભરતી સંબંધી તમામ સુચનાઓ /વિગતો વખતો વખત નિયામકશ્રી અનુ જાતિ,કલ્યાણ કચેરીના હેલ્પ લાઈન ટેલીફોન નંબર ૦૭૯-૨૩૨૫૩૨૩૧ પરથી જાણવા મળી શકશે.
- (૨) ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ પસંદગી સમિતિ/ખાતા દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે, અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
- (૩) શારીરિક અશક્તતા ધરાવતાં ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેઈલ્સમાં પોતાની અશક્તતાની ટકાવારી દર્શાવવાની રહેશે.
- (૪) ઉમેદવારે નિયત અરજી પત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ)માં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- (૫) આ સંવર્ગની ભરતી પ્રક્રિયામાં આખરી પસંદગી પામેલ ઉમેદવાર નિમણુંક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે.
- (૬) ઉમેદવાર પોતે આખરી પસંદગી યાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી સંબંધીત જગ્યા ઉપર નિમણુંક કરવાનો દાવો કરવાને હકકદાર થશે નહીં. નિમણુંક કરનાર સત્તાધિકારીને આવી ખાતરી થાય કે જાહેર સેવા સારૂ તે ગુજરાત મુલ્કીસેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ થી ઠરાવેલ નિયમોનુસાર અને આ જગ્યાનપ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર યોગ્ય જણાય તો તે તબક્કે આ ઉમેદવારને નિમણુંક આપવાનો નિર્ણય લઈ શકશે. અને આ બાબતે નિમણુંક સત્તાધિકારી નો નિર્ણય આખરી ગણાશે.
- (૭) આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે જે તે સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોને આધિન રહેશે.
- (૮) આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો પસંદગી સમિતિને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તેમજ તેવા સંજોગોમાં ભરેલ અરજી અને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે નહીં.
- (૯) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તેઓનો ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે મતલબનું કીમીલીયર સર્ટીફિકેટ સક્ષમ સત્તાધિકારીનું નિયમોનુસારનું અધ્યતન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- (૧૦) દરેક જગ્યાઓ માટે ઉમેદવારોએ સ્વખર્ચે પરીક્ષામાં ઉપસ્થિત થવાનું રહેશે.

અરજી કરવાની રીત:-

આ જાહેરાતના સંદર્ભમાં સમિતિ દ્વારા એન.આઈ.સી ની અથવા <http://ojas1.guj.nic.in> વેબસાઈટ મારફત ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર જાહેરાતમાં દર્શાવ્યા તારીખ: ૨૦/૯/૨૦૧૨ (બપોરે ૨-૦૦ કલાક) થી તારીખ. ૧૦/૧૦/૨૦૧૨ (સમય રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ <http://ojas.guj.nic.in> અથવા <http://ojas1.guj.nic.in> પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારે સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ માં વેબસાઈટ <http://ojas.guj.nic.in> અથવા <http://ojas1.guj.nic.in> પર જવું અને તેમાં નીચે જણાવેલ પગથિયા (સ્ટેપ્સ) ને અનુસરીને અરજી પત્રક ભરવું.

(૧) APPLY online પર click કરવું (૨) જગ્યા પર click કરવાથી જગ્યાની વિગતો મળશે. (૩) તેની નીચે APPLY now પર click કરવાથી application format દેખાશે. application format માં સૌ પ્રથમ personel details ઉમેદવારે ભરવી. (અહીં. (*)) કુંદડીની નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે. (૪) personel details ભરાયા બાદ Educational details ભરવા માટે Educational details પર click કરવું. (૫) હવે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર (exam centre) પર click કરવું. અહીં પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર ભરવું. (૬) તેની નીચે self declaration માં yes/no પર click કરવું (૭) હવે save પર click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે અને નંબર ક્રીએટ થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. (૮) હવે પેજના ઉપરના ભાગમાં upload photo પર click કરો અહીં તમારો application number type કરો અને તમારી birth date type કરો ત્યારબાદ ok પર click કરો. અહીં photo અને signature upload કરવાનો છે. (ફોટાનું માપ ૫ સે.મી ઉંચાઈ અને ૩.૬ સે.મી પહોળાઈ અને signature નું માપ ૨.૫ ઉંચાઈ અને ૭.૫ સે.મી પહોળાઈ રાખવી) browse button પર click કરો અને choose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે. તે ફાઈલને select કરો અને open button ને click કરો હવે બાજુ માં તમારો photo દેખાશે. હવે આ જ રીતે signature પણ upload કરવાની રહેશે. (૯) હવે પેજના ઉપરના ભાગમાં confirm application પર click કરો અને application number તથા birth date type કર્યા બાદ ok પર click કરવાથી બે (૨) બટન ૧ application preview ૨ confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જરૂરી જણાય તો edit application ઉપર click કરીને સુધારો કરી લેવો. અરજી confirm કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી confirm બાદ અરજીમાં કોઈપણ સુધારો થઈ શકશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો confirm application પર click કરવું. Confirm application પર click કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. અને સ્ક્રીન ઉપર Confirmation number આવશે. (૧૦) (A) ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢવા print application ઉપર click કરવું. અહીં Confirmation number ટાઈપ કરવાનો અને print પર ક્લિક કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી. (B) અરજીની પ્રિન્ટ બારકોડ વાળી, ફોટાવાળી અને સહીવાળી નીકળશે. જેને ઉમેદવારે સાચવી રાખવી પરીક્ષાના કોલ લેટરની પ્રિન્ટ લેવા માટે આ અરજી ઉપયોગી થશે. (૧૧) જો અરજીમાં આપે મોબાઈલ નંબર આપેલ હશે તો અરજી confirm થયેથી તુરત આપને અરજીમાં દર્શાવેલ નંબર ઉપરથી SMS મળશે આ Confirmation number અત્યંત અગત્યનો હોવાથી તેને સાચવી રાખવો.

આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના ભરતી નિયમો અન્વયે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા ફી અને પરીક્ષા અને પસંદગીની પદ્ધતીની વિગતો અને જાહેરાતની અન્ય તમામ વિગતો <http://ojas.guj.nic.in> અથવા

<http://ojas1.guj.nic.in> ઉપર જોવા મળશે. ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અને ઉમેદવારની નિમણુંક સત્તાધિકારી સમક્ષ રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વય, જાતિ, અન્ય લાયકાતોને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તબક્કે નિમણુંક અધિકારી દ્વારા ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવા ઉમેદવારોની ઉમેદવારી નિમણુંક સત્તાધિકારી /સમિતિના પરામર્શમાં રદ કરવામાં આવશે. તેમજ ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવશે. તેમજ આવા ઉમેદવારોની પસંદગી/નિમણુંક થયેલ હશે. તો સંબંધિત કચેરી દ્વારા સંયુક્ત પસંદગી સમિતિના પરામર્શમાં કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે. આ સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ વખતો વખતા સુધાર્યા મુજબ અને તે અન્વયે આ સંવર્ગના ઘડવામાં આવેલ ભરતી /પરીક્ષા નિયમોને આધીન રહેશે. આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો પસંદગી સમિતિ ને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે. અને પસંદગી સમિતિ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

નોંધ:- આ જાહેર ખબર અંગે પૂછ પરછ માટે કચેરી સમય દરમ્યાન ૦૭૯-૨૩૨૫૩૨૩૧ પર સંપર્ક કરી શકાશે.

તારીખ- ૨૦/૯/૨૦૧૨

સ્થળ:- ડૉ.જીવરાજ મહેતા ભવન,
બ્લોક નં.૪, બીજોમાળ, ગાંધીનગર

અધ્યક્ષ

સીધી ભરતી પસંદગી સમિતિ અને
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર